

નૂતન નાગરિક સહકારી બેંક- સર્વિસ ચાર્જની વિગત

Sr	Type of Service	Revised Service Charge + GST w.e.f 27.03.2025	સુધારેલ સર્વિસ ચાર્જ તા. 27-03-2025 થી અમલમાં
1	Inward Bills for Collection [Per bill] ઇનવર્ડ બીલ કોલેક્શન- [પ્રતિ બીલ]	Rs.1.00 Per Rs.1000/- (Minimum Rs.10/-) + Rs.50/- Postage + D.D Charges As Applicable + GST	રૂ.1/- પ્રતિ રૂ.1000/- (લઘુત્તમ રૂ.10/-) + રૂ.50/- પોસ્ટેજ + ડી.ડી. ચાર્જ જે મુજબ છે તે પ્રમાણે + જી.એસ.ટી.
1a)	Outward Bills for Collection [Per bill] આઉટવર્ડ બીલ્સ કોલેક્શન- [પ્રતિ બીલ]	1. Upto Rs.5000/- Rs.50 (Including Postage) + GST	1. રૂ.5000/- સુધી રૂ.50/- (પોસ્ટેજ સાથે) + જી.એસ.ટી.
		2. Rs.5,001/- to Rs.10,000/- Rs.1.00 per Rs.1000/- + postage Rs.50/- (Minimum Rs.50/- & Maximum Rs.100/-) + GST	2. રૂ.5001/- થી રૂ.10,000/- સુધી રૂ.1/- પ્રતિ રૂ.1000/- + પોસ્ટેજ રૂ.50/- (લઘુત્તમ રૂ.50/- અને મહત્તમ રૂ.100/-) + જી.એસ.ટી.
		3. Rs.10,001/- to Rs.1,00,000/- Rs.1.00 per Rs.1000/- + postage Rs.50/- (Maximum Rs.100/-) + GST	3. રૂ.10,001/- થી રૂ.1,00,000/- સુધી રૂ.1/- પ્રતિ રૂ.1000/- + પોસ્ટેજ રૂ.50/- (મહત્તમ રૂ.100/-) + જી.એસ.ટી.
		4. Rs.1,00,000/- and above Rs.1.00 per Rs.1000/- + postage Rs.50/- (Maximum Rs.150/-) + GST	4. રૂ.1,00,000/- અને તની ઉપર રૂ.1/- પ્રતિ રૂ.1000/- + પોસ્ટેજ રૂ.50/- (મહત્તમ રૂ.150/-) + જી.એસ.ટી.
2	Syndicate ASBA rejection charges [Per Application] સિન્ડિકેટ અસબા રીજેક્શન ચાર્જ (અરજી ફીઠ)	Rs.300/- + GST	રૂ.300/- + જી.એસ.ટી.
3	Documentary Demand / Docu. Ussance Bills for collection ડોક્યુમેન્ટરી ડિમાન્ડ / ડોક્યુ. યુઝાન્સ બીલ કોલેક્શન	Rs.0.30 per Rs.100/- [Minimum Rs.20/-] Per Bill + Rs. 25/- Postage + GST	0.30/- પૈસા પ્રતિ રૂ.100/- (લઘુત્તમ રૂ.20/-) પ્રતિ બીલ + રૂ.25/- પોસ્ટેજ + જી.એસ.ટી.
4	Inward Cheques Return / ECS Debit Return ઇનવર્ડ ચેક રિટર્ન / ઇસીએસ રીટર્ન	Up to Rs 1.00 lac - Rs.150/- + GST above 1.00 lac to 2.50 lacs - Rs.200/- + GST above 2.5 lacs to 5.00 lacs - Rs.250/- + GST above 5.00 lacs to 15.00 lacs - Rs.500/- + GST Above 15 lac - Rs.750/- + GST	(1) રૂ.1 લાખ સુધી રૂ.150/- + જી.એસ.ટી. (2) રૂ.1 લાખ થી રૂ.2.50 લાખ સુધી રૂ.200/- + જી.એસ.ટી. (3) રૂ.2.50 લાખ થી 5.00 લાખ સુધી રૂ.250/- + જી.એસ.ટી. (4) રૂ.5.00 લાખ થી 15.00 લાખ સુધી રૂ.500/- + જી.એસ.ટી. (5) રૂ.15 લાખ થી વધુ રૂ.750/- + જી.એસ.ટી.
	CD/CC/OD Saving A/C [Cheque/ECS] સીડી/સીસી / ઓડી સેવિંગ એકાઉન્ટ (ચેક / ઇસીએસ)		
	Standing Instruction (SI) - Fail due to insufficient Fund સ્ટેન્ડીંગ ઇન્સ્ટ્રક્શન ફેઇલ- પૂરતા બેલેન્સ ના અભાવે	Rs.150/- + GST	રૂ.150/- + જી.એસ.ટી.
5	Outward Cheque Return આઉટવર્ડ રીટર્ન ચેક		
	Current A/C.- કરન્ટ ખાતા	Rs.100/- + GST	રૂ.100/- + જી.એસ.ટી.
	C.C. / O/D A/C.- સીસી/ ઓવર ડ્રાફ્ટ ખાતા	Rs.100/- + GST	રૂ.100/- + જી.એસ.ટી.
	Loan A/C (Chq./ ECS RET.) લોન ખાતા (ચેક / ઇસીએસ રીટર્ન)	Rs.300/- + GST	રૂ.300/- + જી.એસ.ટી.
	Savings A/Cs - બચત ખાતા	Rs.50/- + GST	રૂ.50/- + જી.એસ.ટી.
6	Cheque Book Issue		
	Savings A/Cs. બચત ખાતા	48 Cheque free p.a. if Minimum Average Balance in the A/c was more than Rs.1000/- per quarter. In other A/c Rs.2/- Per Cheques + GST	ખાતામાં ત્રણ મહિનાનું સરેરાશ બેલેન્સ રૂ.1000/- કરતા વધુ રહેતું હોય તો વાર્ષિક 48 ચેક નો કોઈ જ ચાર્જ નહિ . તેના સિવાય ના ખાતામાં રૂ.2/- પ્રતિ ચેક + જી.એસ.ટી.
	Current / CC / OD A/C. કરન્ટ /સીસી/ ઓ.ડી. ખાતા	Rs. 3/- Per cheque + GST	રૂ.3/- પ્રતિ ચેક + જી.એસ.ટી.
7	Demand Drafts - ડિમાન્ડ ડ્રાફ્ટ		
	HDFC Bank Cheques એચ.ડી.એફ.સી બેંક ચેકસ	(1) Upto Rs.25000/- Rs.30/- + GST (2) Rs.25001/- to Rs.100000/- Rs.50/- + GST (3) Above Rs.100000/- Rs.100/- + GST Cancellation/Revalidation/Duplication Charge- Rs 20/- + GST	(1) રૂ.25,000/- સુધી રૂ.30/- + જી.એસ.ટી. (2) રૂ.25,001/- થી રૂ.1,00,000/ સુધી રૂ.50/- + જી.એસ.ટી. (3) રૂ.1,00,000/ થી ઉપર રૂ.100/- + જી.એસ.ટી. રદખાતલ - (રિવેલિડેશન અને ડુપ્લીકેશન ખર્ચ રૂ.20/- + જી.એસ.ટી.

Sr	Type of Service	Revised Service Charge + GST w.e.f 27.03.2025	સુધારેલ ચાર્જ તા. 27-03-2025 થી અમલમાં
8	Pay Order- પે- ઓર્ડર	(1)Upto Rs.25000/-Rs.30/- + GST (2) Rs.25001/- to Rs.100000/- Rs.50/- + GST (3)Above Rs.100000/- RS.100/- + GST Cancellation/Revalidation/Duplication Charge- Rs 20/-+ GST	(1) રૂ. 25,000/-સુધી રૂ.30/- + જી.એસ. ટી. (2) રૂ. 25,001/- થી રૂ. 1,00,000/ સુધી રૂ.50/-+ જી.એસ.ટી. (3)રૂ. 1,00,000/ થી ઉપર રૂ. 100/- + જી.એસ. ટી. રદબાતલ - રિવેલીટેશન અને ડુપ્લીકેશન ખર્ચ રૂ.20/- + જી.એસ. ટી.
9	Outward Transaction-(Physical) આઉટવર્ડ ટ્રાન્ઝેક્શન - (પ્રત્યક્ષ)	Physical	પ્રત્યક્ષ
	(i) RTGS - આર.ટી.જી.એસ.	Rs.2.00 to 5.00 Lacs - Rs.25/- +GST Above Rs 5.00 lacs - Rs.50/- +GST	રૂ. ૨ થી ૫ લાખ સુધી - રૂ. 25/-+ જી.એસ. ટી. રૂ. ૫ લાખ થી વધુ - રૂ. 50/-+જી.એસ. ટી.
	(ii) NEFT - એન. ઇ. એફ. ટી	Upto Rs.1.00 lac - Rs.10/- +GST above 1.00 lac - Rs.20/- +GST	રૂ. 1 લાખ સુધી - રૂ. 10/-+જી.એસ. ટી. રૂ. 1 લાખ થી વધુ - રૂ. 20/-+જી.એસ. ટી.
	Inward Transaction- ઇનવર્ડ ટ્રાન્ઝેક્શન		
	(i) RTGS- આર.ટી.જી.એસ.	Nil	કોઈ ચાર્જ નહિ
	(ii) NEFT- એન. ઇ. એફ. ટી	Nil	કોઈ ચાર્જ નહિ
	(iii) ECS - ઇ.સી.એસ	Nil	કોઈ ચાર્જ નહિ
10	SMS Charges એસ. એમ એસ ચાર્જ		
	(i)Savings AC બચત ખાતા	Per SMS charges Rs.0.20 First four message free Minimum Rs.1/- + GST Per Quarter from fifth SMS onwards Maximum Rs.6/-+ GST Per Quarter	રૂ. 0.20 પ્રતિ એસ. એમ એસ , પહેલા ચાર એસ. એમ એસ મફત રહેશે, લઘુતમ રૂ. 1/- ત્રિમાસિક ધોરણે પાંચમા મેસેજથી લાગુ પડશે મહત્તમ રૂ. 6/- ત્રિમાસિક ધોરણે
	(ii) Current AC / Cash Credit A/c ચાલુ તથા કશ ક્રેડિટ ખાતા માટે	Per SMS charges Rs.0.20 First four message free Minimum Rs.1/- + GST Per Quarter from fifth SMS onwards Maximum Rs.12/-+ GST Per Quarter	રૂ. 0.20 પ્રતિ એસ. એમ એસ , પહેલા ચાર એસ. એમ એસ મફત રહેશે, લઘુતમ રૂ. 1/- ત્રિમાસિક ધોરણે પાંચમા મેસેજથી લાગુ પડશે મહત્તમ રૂ. 12/- ત્રિમાસિક ધોરણે
11	Cash Charges – કેશ ચાર્જસ	AS PER CASH CHARGE STRUCTURE - Annexure - 1	ખર્ચના શિડયુલડ મુજબ બિડાણ-1
12	FI Charges / Processing Fee એફ. આઈ.ચાર્જસ/ પ્રોસેસીંગ ચાર્જસ	(A) Other than Car Loan (1) For, Advances upto Rs.2 Lac - Rs.500/- + GST (2) For, Advances above Rs.2 Lac & up to Rs.10 Lac - Rs.3,000/-+ GST (3) (i)For, Advances above Rs.10 Lac - 0.50% (Maximum Rs.5,00,000/-) + GST (ii) For, Advances above Rs.10 Lac (for existing borrower enjoying working capital limit from our bank) - 0.35% (Maximum Rs.3,50,000/-)+ GST (4) For, CRE Finance - 0.50% + GST (B) For Car Loan (New) (1) Rs.1000/- + GST for Loan upto Rs.5,00,000/-. (2)Rs.2,000/- + GST for Loan above Rs.5,00,000/- & up to Rs.10,00,000/- (3)Rs.3,000/- + GST for Loan above Rs.10,00,000/- & up to Rs.15,00,000/- (4)Rs.4,000/- + GST for Loan above Rs.15,00,000/- & up to Rs.20,00,000/- (5)Rs.5,000/- + GST for Loan above Rs.20,00,000/- & up to Rs.25,00,000/- (6)Rs.6,000/- + GST for Loan above Rs.25,00,000/- & up to Rs.50,00,000/- (7)Rs.7,500/- + GST for Loan above Rs.50,00,000/- * Processing fees also to be recovered from existing customer in case of increase in limit. It should be recovered on 0.35% + GST of enhancement / addition in present sanctioned limit. *No Processing fee for OD agst.FDR, Loan/OD agst. Govt. Securities, LIC, Demat Shares.	(A) કાર લોન સિવાયના ચાર્જસ (1) રૂપિયા 2 લાખ સુધીના વિરાણ માટે રૂ.500/- + જી.એસ.ટી. (2) રૂપિયા 2 લાખ થી ઉપર અને 10 લાખ સુધીના વિરાણ માટે રૂ.3000/-+ જી.એસ.ટી. (3) (i) રૂપિયા 10 લાખ થી ઉપરના વિરાણ માટે 0.50 % મહત્તમ રૂ.5,00,000/-+ જી.એસ.ટી. (ii) રૂપિયા 10 લાખ થી ઉપરના વિરાણ માટે (હાલના વર્કિંગ કેપિટલ વિરાણ ધારક માટે) 0.35 % મહત્તમ રૂ.3,50,000/-+ જી.એસ.ટી. (4) સી.આર.ઈ. વિરાણ માટે - 0.50 % + જી.એસ.ટી. લાગુ પડશે (B) કાર લોન (નવી) ના ચાર્જસ (1) રૂપિયા 5 લાખ સુધીના વિરાણ માટે રૂ.1000/- + જી.એસ.ટી. (2) રૂપિયા 5 લાખ થી ઉપર અને 10 લાખ સુધીના વિરાણ માટે રૂ.2000/-+ જી.એસ.ટી. (3) રૂપિયા 10 લાખ થી ઉપર અને 15 લાખ સુધીના વિરાણ માટે રૂ.3000/-+ જી.એસ.ટી. (4) રૂપિયા 15 લાખ થી ઉપર અને 20 લાખ સુધીના વિરાણ માટે રૂ.4000/-+ જી.એસ.ટી. (5) રૂપિયા 20 લાખ થી ઉપર અને 25 લાખ સુધીના વિરાણ માટે રૂ.5000/-+ જી.એસ.ટી. (6) રૂપિયા 25 લાખ થી ઉપર અને 50 લાખ સુધીના વિરાણ માટે રૂ.6000/-+ જી.એસ.ટી. (7) રૂપિયા 50 લાખ થી ઉપર ના વિરાણ માટે રૂ.7500/-+ જી.એસ.ટી. * એક ના હાલના ગ્રાહક કે જેઓ તેમની હાલની લીમીટ વધારવા માંગે છે તેમની પાસેથી વધારાની લીમીટ ઉપર 0.35 % + જી.એસ.ટી. પ્રોસેસીંગ ફી તરીકે લેવી * એફ.ટી.આર / ગવર્નમેન્ટ સીક્યુરિટી / એલ.આઈ.સી. તથા ડિમેટ શેર સામે જે ઓવર ડ્રાફ્ટ આપવામાં આવે છે તેમાં કોઈ જ પ્રોસેસીંગ ફી થશે નહિ. * વધુ માહિતી માટે પ્રોસેસીંગ ચાર્જ અંગેનો સરકયુલર વાંચવો.
13	Incidental / Folio Charges- ઇન્સીડેન્ટલ ખર્ચ		

Sr	Type of Service	Revised Service Charge + GST w.e.f 27.03.2025	સુધારેલ સર્વિસ ચાર્જ તા. 27-03-2025 થી અમલમાં
	For CD/CC/OD A/Cs કરન્ટ /સીસી/ ઓ.ડી. ખાતા	Rs. 0.90 per entry [Minimum Rs.200/- Half Yearly] + GST	રૂ.0.90 પૈસા પ્રતિ એન્ટ્રી (લઘુત્તમ રૂ. 200/- અર્ધ વાર્ષિક) + જી.એસ.ટી.
14	Bank Guarantee- બેંક ગેરંટી	[When Issued by our Banks Only]	જ્યારે આપણી બેંક દ્વારા ઈસ્યુ કરવામાં આવે ત્યારે
	(i) Performance / પરફોર્મન્સ ગેરંટી	Rs.2/- per Rs.100/-p.a or part there on quarterly basis+ Rs.100/- issue charge + GST	રૂ. 2 પ્રતિ રૂ. 100/- પ્રતિ વર્ષ અથવા તેના ભાગ પેટે ત્રિમાસિક ધોરણે + રૂ. 100/- ઈસ્યુ ચાર્જસ + જી.એસ.ટી.
	(ii) Financial / નાણાકીય ગેરંટી	Rs.2.25/- per Rs.100/-p.a or part there on quarterly basis + Rs.100/- issue charge + GST	રૂ. 2.25 પ્રતિ રૂ. 100/- પ્રતિ વર્ષ અથવા તેના ભાગ પેટે ત્રિમાસિક ધોરણે + રૂ. 100/- ઈસ્યુ ચાર્જસ + જી.એસ.ટી.
	^ Note : નોંધ	If guarantee issued with 25% cash margin, unsecured portion should be covered by extension of charge by way of equitable mortgage of property or Hypo. of Stock / Book-Debts / Machineries etc.	જો બેંક ગેરંટી 25 % કેશ માર્જિન સાથે ઈસ્યુ કરી લેય તો જે અન-સીક્યોર્ડ ભાગ લેય તે માટે પ્રોપર્ટી નુ ઇક્વિટેબલ મોર્ગેજ અથવા તો સ્ટોક / બુક ડેબ્ટસ / મશીનરી નુ લઈપોથીકેશન કરવાનું રહેશે.
	(iii) With 100 % Margin / 100% માર્જિન સાથે	1. Rs.0.55/- per Rs.100/-p.a or part there on quarterly basis + Rs.100/- issue charge + GST If Bank Guarantee is Rs. 2/- Crore and above. 2. Rs.0.75/- per Rs.100/-p.a or part there on quarterly basis + Rs.100/- issue Charge + GST If Bank Guarantee is below Rs. 2/- Crore. (Minimum Rs.100/-)	1.જો બેંક ગેરંટી રૂ. 2 કરોડ અને તેથી વધુ લેય તો રૂ.0.55 પ્રતિ રૂ. 100/- પ્રતિ વર્ષ અથવા તેના ભાગ પેટે ત્રિમાસિક ધોરણે + રૂ. 100/- ઈસ્યુ ચાર્જસ + જી.એસ.ટી. 2 જો બેંક ગેરંટી રૂ. 2 કરોડ થી ઓછી લેય તો રૂ. 0.75 પ્રતિ રૂ. 100/- પ્રતિ વર્ષ અથવા તેના ભાગ પેટે ત્રિમાસિક ધોરણે + રૂ. 100/- ઈસ્યુ ચાર્જસ + જી.એસ.ટી. (લઘુત્તમ રૂ. 100/-)
	Bank Guarantee- બેંક ગેરંટી	* [When Issued through Other Bank]	અન્ય બેંક દ્વારા ઈસ્યુ કરવામાં આવે ત્યારે
14 (a)	(i) Performance & Financial / પરફોર્મન્સ અને નાણાકીય	Rs.2.75/- per Rs.100/-p.a + GST or part there of on quarterly basis+ Rs.575- issue charge [Minimum 1 Quarter]	રૂ. 2.75 પ્રતિ રૂ. 100/- પ્રતિ વર્ષ અથવા તેના ભાગ પેટે ત્રિમાસિક ધોરણે + રૂ. 575/- ઈસ્યુ ચાર્જસ + જી.એસ.ટી. (લઘુત્તમ એક ક્વાર્ટર)
	(ii) With 100 % Margin / 100% માર્જિન સાથે	Rs.1/- per Rs.100/-p.a + GST or part there on quarterly basis + Rs.575/- issue charge [Minium 1 Quarter]	રૂ. 1/- પ્રતિ રૂ. 100/- પ્રતિ વર્ષ અથવા તેના ભાગ પેટે ત્રિમાસિક ધોરણે + રૂ. 575/- ઈસ્યુ ચાર્જસ + જી.એસ.ટી. (લઘુત્તમ એક ક્વાર્ટર)
		* Branches have to collect Bank Guarantee charges from the party as per above mentioned rate and when advice is received from Head Office respond the advice and directly debit to Profit & Loss a/c.	શાખાઓએ બેંક ગેરંટીના ચાર્જસ ગ્રહક પાસેથી ઉપર જણાવ્યા મુજબ વસૂલ કરી લેવા અને એડવાઈસ જ્યારે હેડ ઓફીસ માંથી આવે ત્યારે તે રીસ્પોન્ડ કરી પ્રોફીટ એન્ડ લોસ ખાતામાં સીધી ઉધારી લેવી.
15	Letter of Credit- લેટર ઓફ ક્રેડીટ	When issued by our Banks only	આપણી બેંક દ્વારા ઈસ્યુ કરવામાં આવે ત્યારે
	Particulars- વિગત	Commission Rates.	કમિશન રેટ
1	LC opening charges/Commitment Charges એલ.સી. ઓપનીંગ ચાર્જસ/ કમિટમેન્ટ ચાર્જસ	0.15% per quarter, with minimum of one quarter, and beyond one quarter 0.05% per month or part thereof + GST	0.15% પ્રતિ ક્વાર્ટર, લઘુત્તમ એક ક્વાર્ટર સાથે, અને એક ક્વાર્ટર કરતા વધુ 0.05% પ્રતિ માસ અથવા તેના ભાગ પેટે + જી.એસ.ટી.
2	Usance charges: યુઝાન્સ ચાર્જસ		
(a)	Sight bills: સાઈટ બીલ્સ	0.15% flat rate per bill + GST.	0.15 % સીધો દર પ્રતિ બીલ + જી.એસ.ટી.
(b)	Usance up to 3 months- યુઝાન્સ બીલ ત્રણ માસ સુધી	0.30% minimum + GST	લઘુત્તમ 0.30% +જી.એસ.ટી.
(c)	Usance beyond 3 months- યુઝાન્સ બીલ ત્રણ માસ થી વધુ	0.30% minimum + 0.10% per month for the period beyond 3 months + GST.	લઘુત્તમ 0.30 % + 0.10% પ્રતિ માસ ત્રણ માસ ઉપરના યુઝાન્સ માટે + જી.એસ.ટી.
	Opening/Commitment + Usance charges. ઓપનીંગ / કમિટમેન્ટ + યુઝાન્સ ચાર્જસ	As above with minimum of Rs. 2000.00 + GST	ઉપર મુજબ પરંતુ લઘુત્તમ રૂ.2000/- + જી.એસ.ટી.
3	Retirement of bills under LC. બીલ્સ અન્ડર એલ.સી. --> રીટાયરમેન્ટ	Rs.500/- flat per bill + GST.	રૂ.500/- સીધો દર પ્રતિ બીલ + જી.એસ.ટી.
4	Amendment of LC એલ.સી. મા ફેરફાર માટે	Rs.1000/- flat rate for each amendment + GST	રૂ.1000/- સીધો દર પ્રતિ એમેન્ડમેન્ટ + જી.એસ.ટી.
5	Swift/ SFMS charges for New LC એલ.સી. માટે સ્વીફ્ટ / એસ.એફ.એમ.એસ.	Rs.300/- flat per bill + GST	રૂ.300/- સીધો દર પ્રતિ બીલ + જી.એસ.ટી.

Sr	Type of Service	Revised Service Charge + GST w.e.f 27.03.2025	સુધારેલ ચાર્જ તા. 27-03-2025 થી અમલમાં
6	Swift/ SFMS charges for amendment સ્વીફ્ટ /એસ.એફ.એમ.એસ. ફેરફાર માટે ચાર્જીસ	Rs.250/- flat per bill + GST	રૂ.250/- સીધો દર પ્રતિ બીલ + જી.એસ.ટી
7	Receipt of discrepant documents. વાળા ડોક્યુમેન્ટના સ્વીકાર માટે	Rs.1000/- flat rate for each amendment + GST	રૂ.1000/- સીધો દર પ્રતિ એમેન્ડમેન્ટ + જી.એસ.ટી
8	Letter of Credit (L/C) CONFIRMATION CHARGES. (only bills to be sent by our bank to LC opener bank- without Discounting of Bills.) PL code-3160	1) Below Rs 10 Lakhs : Rs 1000/- + postage + GST 2) Rs 10 Lakhs & above : Rs 2000/- + postage + GST	1) રૂ.10 લાખ સુધી - રૂ. 1000/- + પોસ્ટેજ + જી.એસ.ટી. 2) રૂ.10 લાખ અને તેથી વધુ - રૂ. 2000/- + પોસ્ટેજ + જી.એસ.ટી.
	* Bank Guarantee and L/cs issued by other Bank charges will be applicable as per respective bank's norms નોંધ- બેંક ગેરંટી અને એલ.સી જ્યારે બીજી બેંક દ્વારા ઈસ્યુ કરવામાં આવશે ત્યારે જે તે બેંક ના નિયમ મુજબ રેટ લાગુ પડશે.		
16	Locker Rent [W.E.F.01/05/2023]	Locker rent as under + GST	લોકર ભાડું નીચેના મુજબ + જી.એસ.ટી
	Locker Type	One year Two Year Three Year	1 વર્ષ માટે 2 વર્ષ માટે 3 વર્ષ માટે
	Size A- સાર્થક- એ	Rs.1,000/- Rs.1,900/- Rs.2,800/-	રૂ. 1,000/- રૂ. 1,900/- રૂ. 2,800/-
	Size B- સાર્થક- બી	Rs.1,300/- Rs.2,600/- Rs.3,800/-	રૂ. 1,300/- રૂ. 2,600/- રૂ. 3,800/-
	Size C- સાર્થક- સી	Rs.1,400/- Rs.2,700/- Rs.4,000/-	રૂ. 1,400/- રૂ. 2,700/- રૂ. 4,000/-
	Size D- સાર્થક- ડી	Rs.1,700/- Rs.3,300/- Rs.5,000/-	રૂ. 1,700/- રૂ. 3,300/- રૂ. 5,000/-
	Size E- સાર્થક- ઈ	Rs.2,000/- Rs.3,900/- Rs.5,700/-	રૂ. 2,000/- રૂ. 3,900/- રૂ. 5,700/-
	Size F- સાર્થક- એફ	Rs.2,700/- Rs.5,200/- Rs.7,800/-	રૂ. 2,700/- રૂ. 5,200/- રૂ. 7,800/-
	Size G- સાર્થક- જી	Rs.2,800/- Rs.5,400/- Rs.8,000/-	રૂ. 2,800/- રૂ. 5,400/- રૂ. 8,000/-
	Size H- સાર્થક- એચ	Rs.3,500/- Rs.6,800/- Rs.9,700/-	રૂ. 3,500/- રૂ. 6,800/- રૂ. 9,700/-
	Size L- સાર્થક- એલ	Rs.5,300/- Rs.10,000/- Rs.14,000/-	રૂ. 5,300/- રૂ. 10,000/- રૂ. 14,000/-
		*Locker operation 60 times free in a one year. Charges of Rs.50+GST applicable per operation there after.	* એક વર્ષમાં લોકર ઓપરેશન 60 વખત ફ્રી ત્યારબાદ પ્રતિ ઓપરેશન રૂ.50/- જી.એસ.ટી. લાગુ
17	Miscellaneous Charges- પરચુરણ ખર્ચ		
	(i) Inspection Charges- ઈન્સપેક્શન ચાર્જ	For C.C. Stock &/or Book-debts Limit 1. Upto Rs.50/- Lacs - Rs.250/- + GST (once in a year) 2. Above Rs.50/- Lacs - Rs.350/- + GST (twice in a year)	સી.સી સ્ટોક અને બુક ડેબ્ટ્સ લિમિટ માટે (1) રૂ. 50 લાખ સુધી રૂ. 250 /- + જી.એસ.ટી.(વાર્ષિક ધોરણે) (2) રૂ.50 લાખ થી વધુ રકમ માટે રૂ.350 /- + જી.એસ.ટી.(અર્ધ-વાર્ષિક ધોરણે)
		Loan / OD agst. Doctor / Medical equipment : Rs 250/- + GST (Once in a year)	લોન/ઓવર ડ્રાફ્ટ - ડોક્ટર / મેડિકલ ઈક્વીપમેન્ટ : રૂ.250 /- + જી.એસ.ટી. (વાર્ષિક ધોરણે)
		Plant & Machinery : Rs 250/- + GST (Once in a year)	પ્લાન્ટ અને મશીનરી લોન : રૂ.250 /- + જી.એસ.ટી. (વાર્ષિક ધોરણે)
		Loan/ OD Business Booster: Rs 250/- + GST (Once in a year)	લોન/ઓવર ડ્રાફ્ટ - બિઝનેસ બૂસ્ટર : રૂ.250 /- + જી.એસ.ટી. (વાર્ષિક ધોરણે)
		Loan /OD agst. Eq. Mortgage of Existing Property : Rs 250/- + GST (Once in a year)	લોન/ઓવર ડ્રાફ્ટ - હયાત પ્રોપર્ટી સામે : રૂ.250 /- + જી.એસ.ટી. (વાર્ષિક ધોરણે)
		OD / Loan CRE Finance : Rs 250/- + GST (Once in a year)	લોન/ઓવર ડ્રાફ્ટ - સી.આર.ઈ. ફાઇનાન્સ : રૂ.250 /- + જી.એસ.ટી. (વાર્ષિક ધોરણે)
		Loan for purchase of property : Rs 250/- + GST (Once in a year)	પ્રોપર્ટી ખરીદવા લોન : રૂ.250 /- + જી.એસ.ટી. (વાર્ષિક ધોરણે)

Sr	Type of Service	Revised Service Charge + GST w.e.f 27.03.2025	સુધારેલ સર્વિસ ચાર્જ તા. 27-03-2025 થી અમલમાં
	(iii)Signature Verification- સાર્થન વેરીફિકેશન ચાર્જસ	RS.50/- + GST	રૂ.50/- + જી.એસ ટી.
	(iv)Stop Payment Instruction Charges- સ્ટોપ પેમેન્ટ ઇન્સ્ટ્રક્શન ચાર્જસ	RS.50/- + GST	રૂ.50/- + જી.એસ ટી.
	(v) Account Clousure- એકાઉન્ટ કલોઝર ચાર્જ	Rs.100/- + GST If Closed Within a year. - Saving A/c Rs.200/- + GST If Closed Within a year. - Current A/c	રૂ.100/- + જી.એસ ટી.- જો બચત ખાતુ એક જ વર્ષ માં બંધ કરવામાં આવે તો રૂ.200/- + જી.એસ ટી. - જો ચાલુ ખાતુ એક જ વર્ષ માં બંધ કરવામાં આવે તો
18	Charges For Non-Maintenance of Minimum Monthly Average Balance લઘુત્તમ માસિક સરેરાશ બેલેન્સ ના હોય તેવા ખાતા ના ચાર્જ	Nil	કોઈ જ ચાર્જ નહિ
	Savings / Current A/C- બચત / ચાલુ ખાતા		
	[For SB Minimum Bal. Rs.1000/-] - બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ રૂ.1000/-		
	[For Cur Minimum Bal. Rs.2000/-]- ચાલુ ખાતામાં લઘુત્તમ બેલેન્સ રૂ.2000/-		
19	Issue of Solvency Certificate - સોલવેન્સી સર્ટીફિકેટ ઇસ્યુ ચાર્જ	[1] upto Rs.1 Lac - Rs.200/-+ GST- [2] Above Rs. 1 Lac to Rs.10 Lac - Rs.500/- + GST [3] Above Rs.10 Lacs - RS.1,500/- + GST	(1) રૂ.1 લાખ સુધી ના સર્ટીફિકેટ માટે રૂ. 200/- + જી.એસ ટી. (2) રૂ.1 લાખ થી રૂ.10 લાખ ના સર્ટીફિકેટ માટે રૂ.500/-+જી.એસ ટી. (3) રૂ.10 લાખ થી ઉપર ના સર્ટીફિકેટ માટે રૂ.1500/- + જી.એસ ટી.
20	ATM Charges- એ.ટી.એમ ચાર્જસ	[1] Upto 5 transaction per month - Nil [2] Above 5 transaction - Per transaction Rs.25/- + GST [3] View statement - Nil	(1) પાંચ ટ્રાન્ઝેક્શન સુધી કોઈ ચાર્જ નહિ (2) પાંચ ટ્રાન્ઝેક્શન ઉપર પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 25/-+ જી.એસ ટી. (3) સ્ટેટમેન્ટ જોવા નો કોઈ જ ચાર્જ નહિ
21	Demat charges- ડિમેટ ચાર્જસ	As per annexure enclosed with account opening form of demat account	એકાઉન્ટ ઓપનીંગ ફોર્મ સાથે બીડેલ એનેક્સર મુજબ
22	Statement Charges - SB - સ્ટેટમેન્ટ ચાર્જસ	Rs.5/- Per Page + GST	રૂ.5/- + પ્રતિ પેઈજ જી.એસ ટી.
	Duplicate Statement Charges-CR/CC ડુપ્લીકેટ સ્ટેટમેન્ટ ચાર્જસ	Rs.5/- Per Page + GST	રૂ.5/- + પ્રતિ પેઈજ જી.એસ ટી.
	Duplicate Pass Book ડુપ્લીકેટ પાસબુક ચાર્જસ	Rs.50/- + GST	રૂ.50/- + જી.એસ ટી.
23	NACH Mandate Charges મેન્ડેટ ચાર્જસ	Rs.50/- +GST	રૂ.50/- + જી.એસ ટી.
24	ASBA Physical Form Printing Charges અસબા ફિઝિકલ ફોર્મ પ્રિન્ટીંગ ચાર્જસ	Rs.10/- Per Form + GST (Exemption for Diamond Category Customers)	રૂ.10/- + જી.એસ ટી.પ્રતિ ફોર્મ (ડાઈમન્ડ કેટેગરી વાળા કસ્ટમર્સ ને લાગુ પડશે નહીં)
25	Operation through POA Mandate - Per Annum પી.ઓ.એ. મેન્ડેટ ચાર્જસ- વાર્ષિક	Rs.100/- + GST (Per Annum)	રૂ.100/- + જી.એસ ટી. વાર્ષિક
26	Modification in POA/ Operation shifting to or from POA પી.ઓ.એ. મેન્ડેટ સંધારા ચાર્જસ	Rs.100/- + GST (Per Instance)	રૂ.100/- + જી.એસ ટી. પ્રતિ સુધારો

Sr	Type of Service	Revised Service Charge + GST w.e.f 27.03.2025	સુધારેલ ચાર્જ તા. 27-03-2025 થી અમલમાં
27	Inquiry related to Old Record (More than three years from date of application) જૂના રેકૉર્ડ કદાવવા માટે ના ચાર્જસ- 3 વર્ષ થી વધુ જૂના રેકૉર્ડ માટે	Rs.5/- per Page + GST - Minimum Rs.100/- +GST	રૂ.5/- + જી.એસ.ટી. પ્રતિ પેજ - લઘુત્તમ રૂ.100/-
28	Limit Renewal Charges લીમીટ રિન્યુઅલ ચાર્જસ	As per Limit Renewal Charge Structure - Annexure - 2	રિન્યુઅલ ચાર્જસ બિડાણ-2 મુજબ
29	Modification/Change in terms & conditions નિયમો અને શરતો માં સુધારા અંગે	Any type of modification as listed below, Flat charges of Rs.500/- + GST to be recovered, per modification i) Change in Collateral Security, ii) Change in Gurantor/s, iii) Release of Personal Guarantee/ Collateral Security, iv) Change in items of machinery,quotations interchangeability of limits, v) Change in constitution.	નીચે મુજબના કોઈપણ સુધારા માટે રૂ. 500/- પ્રતિ સુધારા + જી.એસ.ટી. 1) કોલેટરલ સિક્યોરીટીમાં ફેરફાર 2) જામીન માં ફેરફાર 3) જામીન કે કોલેટરલ સિક્યોરીટી છુટી કરવા 4) કોલેશનમાં ફેરફાર કે મશીનરીની આઈટમમાં સુધારો 5) બંધારણમાં ફેરફાર
30	Stock Audit Fees સ્ટોક ઓડિટ ફી	Limit Audit Fees + GST 3-5 Crores 4,500/- 5-10 Crores 5,250/- 10 Crores & Above 7,500/-	લીમીટ ઓડિટ ફી + જી.એસ.ટી. 3 થી 5 કરોડ રૂ. 4,500/- 5 થી 10 કરોડ રૂ. 5,250/- 10 કરોડ થી વધુ રૂ. 7,500/-
31	Adhoc Limit Charges એડહોક લીમીટ ચાર્જસ	1.5% p.a.+GST on Adhoc limit sanctioned for the period of adhoc limit	1.5% પ્રતિ વર્ષ + જી.એસ.ટી. એડહોક લીમીટ તથા એડહોક લીમીટના સમયગાળા માટે
32	Commitment Charges કમિટમેન્ટ ચાર્જસ Utilizations (%) વપરાશ (1) Less than 40% - વપરાશ 40% કરતા ઓછો (2) More than 40% and less than 60% - 40% કરતા વધારે અને 60% કરતા ઓછો	charges will be levied on quarterly basis on un-utilised portion as under (1) 0.50% + GST (2) 0.25% + GST	વાર્ષ વપરાયેલ ભાગ ઉપર નીચે મુજબ ત્રિ-માસીક ચાર્જ વસૂલ કરવામાં આવશે. (1) 0.50% + જી.એસ.ટી. (2) 0.25% + જી.એસ.ટી.
33	Foreclosure / Prepayment charges in case of Business/ Commercial/ Other Commercial Loans & Working Capital Limits: ફોરકલોઝર / પ્રિ-પેમેન્ટ ચાર્જસ : બીઝનેસ, કોમર્શિયલ તથા વર્કિંગ કેપિટલ લિમીટ પર લાગુ	1. (a) @4% p.a. (on outstanding amount) : In case of loan closed within 1 year from the date of 1st disbursement. 1. (b) @4% p.a. (on amount of limit sanctioned) : In case of limit closed within 1 year from the date of release of working capital limit. 2. (a) @2% p.a. (on outstanding amount) : In case of loan closed after 1 year but before completion of 2nd year from the date of 1st disbursement. 2. (b) @2% p.a. (on amount of limit sanctioned) : In case of limit closed after 1 year but before completion of 2nd year from the date of release of working capital limit. 3. (a) @1.5% p.a. (on outstanding amount) : In case of loan closed any time after 2nd year from the date of 1st disbursement. 3. (b) @1.5% p.a. (on amount of limit sanctioned) : In case of limit closed any time after 2nd year from the date of release of working capital limit.	1. (a) @4% વાર્ષિક (લોન ની બાકીની રકમ ઉપર) : જો લોન ડિસબર્સ કર્યાનાં એક વર્ષ માં જ બંધ કરવામાં આવે તો. 1. (b) @4% વાર્ષિક (લિમીટ સેકશન ની રકમ ઉપર) : જો લિમીટ રિલીઝ કર્યા ના એક વર્ષ માં જ ભરપાઈ કરવામાં આવે તો. 2. (a) @2% વાર્ષિક (લોન ની બાકીની રકમ ઉપર) : જો લોન ડિસબર્સ કર્યાનાં એક વર્ષ બાદ પરંતુ બીજુ વર્ષ પૂર્ણ થતા પહેલા જ બંધ કરવામાં આવે તો. 2. (b) @2% વાર્ષિક (લિમીટ સેકશન ની રકમ ઉપર) : જો લિમીટ રિલીઝ કર્યા ના એક વર્ષ બાદ પરંતુ બીજુ વર્ષ પૂર્ણ થતા પહેલા જ ભરપાઈ કરવામાં આવે તો. 3. (a) @1.5% વાર્ષિક (લોન ની બાકીની રકમ ઉપર) : જો લોન ડિસબર્સ કર્યાનાં બે વર્ષ બાદ બંધ કરવામાં આવે તો. 3. (b) @1.5% વાર્ષિક (લિમીટ સેકશન ની રકમ ઉપર) : જો લિમીટ રિલીઝ કર્યા ના બે વર્ષ બાદ ભરપાઈ કરવામાં આવે તો.